



પરિપત્ર

વિષય : ખેલ મહાકુંભ-૨૦૨૨ અંતર્ગત રજીસ્ટ્રેશન કરવા બાબત.

સંદર્ભ : જીલ્લા રમત ગમત અધિકારીની કચેરીના પત્ર ક્રમાંક જરગઅ/ખે.મ.કું-૨૨/૨૦૨૧-૨૨ તા. ૨૨/૦૨/૨૦૨૨ અન્વયે

ઉપરોક્ત વિષય અને સંદર્ભે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી-જૂનાગઢ સંલગ્ન તમામ કોલેજોના આચાર્યશ્રીઓ, અનુસ્નાતક કેન્દ્રોના વડાશ્રીઓ તેમજ અનુસ્નાતક ભવનના અધ્યક્ષશ્રીઓને જણાવવાનું કે ગુજરાત સરકારશ્રીના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેલ મહાકુંભ ૨૦૨૨નું આયોજન હાથ ધરવામાં આવનાર છે.

ખેલ મહાકુંભ-૨૦૨૨માં તાલુકા/ઝોનકક્ષા, જિલ્લા/મહાનગરપાલિકા કક્ષા અને છેલ્લે રાજ્યકક્ષા સુધી વિવિધ રમતોની સ્પર્ધા યોજાનાર છે જે માટે કોલેજ દ્વારા સૌપ્રથમ સંદર્ભદર્શિત પત્ર માં આપેલ વેબસાઇટ પર ઓનલાઇન કોલેજનું નવું રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. ત્યારબાદ જ કોલેજના લોગ ઇન માં જઈ તમામ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તા.૧૭/૦૨/૨૦૨૨થી શરૂ કરવામાં આવેલ છે.

કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓ ઓનલાઇન તેમજ કોલેજ મારફતે રજીસ્ટ્રેશન કરી શકશે. અભ્યાસ ન કરતા ખેલાડીઓ પણ પોતાના ગામની શાળા/હાઇસ્કૂલમાંથી રજીસ્ટ્રેશન કરાવી શકશે. કોલેજના જવાબદારી વ્યક્તિને પાસવર્ડ આપવાનો રહેશે તેમજ તે વ્યક્તિએ રજીસ્ટ્રેશનની સંપૂર્ણ કામગીરી જોવાની રહેશે. આપની કોલેજ દ્વારા વધુમાં વધુ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થાય તેમજ વધુમાં વધુ વિદ્યાર્થીઓ ભાગ લે તેવા પ્રયત્નો કરવાના રહેશે. રજીસ્ટ્રેશનમાં કોઈ મુશ્કેલી જણાય તો ટોલ ફ્રી નં ૧૮૦૦ ૨૭૪ ૬૧૫૧ અને ૦૨૮૫ ૨૬૩૦૪૯૦ પર સંપર્ક કરવાનો રહેશે.


કા.કુલસચિવ

બિડાણ: સંદર્ભ પત્રની નકલ

ક્રમાંક : બીકેએનએમયુ/એકેડેમિક/૨૯૭/૨૦૨૨

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી,

ગવર્મેન્ટ પોલીટેકનીક કેમ્પસ, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી રોડ, ખડીયા, જૂનાગઢ

તા. ૨૩/૦૨/૨૦૨૨

પ્રતિ,

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ. સંલગ્ન તમામ કોલેજોના આચાર્યશ્રીઓ, અનુસ્નાતક કેન્દ્રોના વડાશ્રીઓ તેમજ અનુસ્નાતક ભવનના અધ્યક્ષશ્રીઓ તરફ.

નકલ સાદર રવાના :

માનનીય કુલપતિશ્રી/કુલસચિવશ્રીનાં અંગતસચિવશ્રી

નકલ સાદર રવાના જાણ તથા યોગ્ય કાર્યવાહી અર્થે :

આઈ.ટી. સેલ (વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવા અર્થે)

ક્રમાંક: જરગઅ/ખે.મ.કું-૨૨/૨૦૨૧-૨૨
જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી,
બ્લોક નં.૧ / પ્રથમ માળ, બહુમાળી ભવન,
સરદાર બાગ, જુનાગઢ -૩૬૨૦૦૧
ફોન નં. ૦૨૮૫ ૨૫૬૩૦૪૯૦
ઈ મેલ ksqj.unagadhci1y20@gmail.com
તા.૨૨/૦૨/૨૦૨૨

પ્રતિ,
આચાર્યશ્રી/પ્રિન્સિપલ
પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ.મા.શાળા,
સરકારી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ, આર.એમ.એસ.એ. શાળાઓ/કોલેજો તમામ
જુનાગઢ, જિલ્લો જુનાગઢ

વિષય : ખેલ મહાકુંભ-૨૦૨૨ અંતર્ગત રજીસ્ટ્રેશન કરવા બાબત.
સંદર્ભ:- માન.સચિવશ્રી, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર
ના પત્ર ક્ર: [SMD/KMK/2022/267](#) તા. ૧૫/૦૨/૨૦૨૨

ઉપરોક્ત વિષય તથા સંદર્ભ અન્વયે જણાવવામાં આવે છે કે, ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેલ મહાકુંભ-૨૦૨૨નું આયોજન હાથ ધરવામાં આવનાર છે.

ખેલમહાકુંભ-૨૦૨૨માં શાળા/ગ્રામ્યકક્ષા, તાલુકા/ઝોનકક્ષા, જિલ્લા/મહાનગરપાલિકાકક્ષા અને છેલ્લે રાજ્યકક્ષા સુધી વિવિધ રમતોની સ્પર્ધા યોજનાર છે. જે માટે વેબસાઈટ [www. https://khelnmahakumbh.gujarat.gov.in/](http://www.khelnmahakumbh.gujarat.gov.in/) પર થી ઓનલાઈન રજીસ્ટ્રેશન તા.૧૭/૦૨/૨૦૨૨ થી શરૂ કરવામાં આવેલ છે. અં-૧૧, અં-૧૪, અં-૧૭ તથા ઓપન એઈજ (સિનિયર) ગ્રુપમાં શાળામાં અભ્યાસ કરતાં ખેલાડીઓએ જે તે શાળામાંથી રજીસ્ટ્રેશન કરવાનું ફરજિયાત રહેશે. કોલેજમાં અભ્યાસ કરતાં ખેલાડીઓએ ઓનલાઈન તેમજ કોલેજ મારફતે રજીસ્ટ્રેશન કરી શકશે. અભ્યાસ ન કરતાં હોય તેવા ખેલાડીઓ પણ પોતાના ગામની સ્કૂલ/હાઈસ્કૂલમાંથી રજીસ્ટ્રેશન કરાવી શકશે. શાળા/કોલેજ અંગેનો પાસવર્ડ સ્કૂલ, કોલેજના જવાબદાર વ્યક્તિને આપવાનો રહેશે અને તેમના દ્વારા રજીસ્ટ્રેશનની કામગીરી થાય તે જોવાનું રહેશે. શાળા/કોલેજો એ ખેલમહાકુંભની વેબસાઈટ પર સૌપ્રથમ નવુ શાળા/કોલેજનું રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત રહેશે. ત્યારબાદ જ શાળા/કોલેજના લોગ ઈન માં જઈ શાળા/કોલેજના તમામ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

આપની શાળા/કોલેજ દ્વારા વિદ્યાર્થીઓના વધુમાં વધુ રજીસ્ટ્રેશન થાય તેવા પ્રયત્નો કરવાના રહેશે. રજીસ્ટ્રેશનમાં કોઈ મુશ્કેલી જણાય તો ટોલ ફ્રી (સવારના ૧૦:૩૦ થી સાંજના ૦૬:૧૦) નંબર - ૧૮૦૦ ૨૭૪ ૬૧૫૧ અને ૦૨૮૫ ૨૬૩૦૪૯૦ પર સંપર્ક કરવાનો રહેશે.

બિડાણ:- ફોર્મનો નમુનો(રમતોની વિગતવાર માહિતી)

જિલ્લા રમત ગમત અધિકારી
જુનાગઢ

જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી
જુનાગઢ

જિલ્લા શિક્ષણ અધિકારી
જુનાગઢ

નકલ સવિનય જાણ સારૂ:

- (૧) માન. કલેક્ટરશ્રી, જુનાગઢ
- (૨) માન. કમિશનરશ્રી, મહાનગરપાલિકા જુનાગઢ
- (૩) માન. સચિવશ્રી, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર
- (૪) માન. ખાસ ફરજ પરના અધિકારી, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર

નકલ રવાના જરૂરી કાર્યવાહી થવા સારૂ:

- (૧) માન. વાઈસ ચાન્સેલરશ્રી, કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ (આપના તાબાની કોલેજોને જાણ કરવા વિનંતી)
- (૨) માન. વાઈસ ચાન્સેલરશ્રી, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ (//)
- (૩) માન. નાયબ માહિતી નિયામકશ્રી, જુનાગઢ (વિના મૂલ્યે અખબારી યાદી આપવા સારૂ)
- (૪) તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, તમામ જુનાગઢ જિલ્લો (આપના તાબાની શાળાઓને જાણ કરવા સારૂ)

વ્યક્તિગત રમત તથા સાંધિક રમત માટેનું પ્રવેશપત્ર (કોઈ પણ એકજ રમતમાં તથા વજન ગ્રુપમાં અને એકજ વયજૂથમાં ભાગ લઈ શકાશે) અંડર-૧૧, અંડર-૧૪, અંડર-૧૭ સ્પર્ધા માટે શાળા મારફત રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે													
KMK ID: _____													
આધાર ડાટાસ નંબર _____													
૧. શાળા/કોલેજ નું નામ*	_____												
૨. વય જૂથ* (૩૧-૧૨-૨૦૨૧ની સ્થિતિએ)	<table border="1"> <tr> <td>અં-૧૧</td> <td>અં-૧૪</td> <td>અં-૧૭</td> <td>ઓપન એજ ગ્રુપ (૧૭ થી ૪૫ વર્ષ સુધી)</td> <td>ભાઈઓ</td> <td>બહેનો</td> </tr> <tr> <td>_____</td> <td>_____</td> <td>_____</td> <td>_____</td> <td>_____</td> <td>_____</td> </tr> </table>	અં-૧૧	અં-૧૪	અં-૧૭	ઓપન એજ ગ્રુપ (૧૭ થી ૪૫ વર્ષ સુધી)	ભાઈઓ	બહેનો	_____	_____	_____	_____	_____	_____
અં-૧૧	અં-૧૪	અં-૧૭	ઓપન એજ ગ્રુપ (૧૭ થી ૪૫ વર્ષ સુધી)	ભાઈઓ	બહેનો								
_____	_____	_____	_____	_____	_____								
૩. રમતનું નામ*	_____												
૪. સબ ઈવેન્ટ*	_____												
૧. ખેલાડીનું નામ*	_____												
૨. જન્મ તારીખ*	<table border="1"> <tr> <td>_____</td> <td>_____</td> <td>_____</td> <td>_____</td> <td>_____</td> <td>_____</td> <td>_____</td> <td>_____</td> <td>_____</td> <td>_____</td> </tr> </table>	_____	_____	_____	_____	_____	_____	_____	_____	_____	_____		
_____	_____	_____	_____	_____	_____	_____	_____	_____	_____				
૫. મોબાઇલ નંબર* :	_____												
૬. ઇ-મેઇલ આઇડી	_____												
૭. વાલીનું નામ* :	_____												
૮. ઘરનું સરનામું* :	_____												
૯. જિલ્લો/મહાનગરપાલિકા*	_____ તાલુકો : _____ ગામ : _____												
૧૦. બેન્કની વિગત	બેન્કનું નામ :- _____ બ્રાન્ચ :- _____ એકાઉન્ટ નંબર :- _____ IFSC કોડ :- _____												
૧૧. આધાર કાર્ડ નંબર	_____												
૧૨. કોચ/વ્યાયામ શિક્ષકનું નામ	_____												
૧૩. કોચ/વ્યાયામ શિક્ષકનાં ઘરનું સરનામું :	_____												
૧૪. કોચ/વ્યાયામ શિક્ષકનો મોબાઇલ નંબર :	_____												
નોંધ :- *ચિન્હ કરેલી વિગતો ભરવી ફરજિયાત છે.													

રજીસ્ટ્રેશન અંગે સુચનાઓ

- અંડર-૧૧, અંડર-૧૪, અંડર-૧૭ સ્પર્ધા માટે શાળા મારફત રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે
- ઓપન એજ ગ્રુપ તથા અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓએ પોતાનું રજીસ્ટ્રેશન (૧) શાળા/કોલેજમાં (૨) જિલ્લા રમતગમત અધિકારીની કચેરી (૩) સિનિયર કોચની કચેરી (૪) મોબાઇલ એપ (એન્ડ્રોઇડ અને આઈ.ઓ.એસ.) (૫) વેબપોર્ટલ (khelmahakumbh.gujarat.gov.in) મારફતે કરાવવાનું રહેશે

બાહેધરી:-

- સ્પર્ધા દરમિયાન કોઈ પણ જાતની શારીરિક હાની થશે તો તેની જવાબદારી મારી અને મારા વાલીની રહેશે. આયોજકની કોઈ જવાબદારી રહેશે નહીં.
- હું રજીસ્ટ્રેશન સમગ્ર રાજ્યમાંથી ફક્ત એકજ સ્થળેથી કરીશ અન્યથા મારું રજીસ્ટ્રેશન રદ બાતલ ગણાશે.
- હું _____ આથી બાહેધરી આપુ છું જે હું ખેલમહાકુંભમાં વિજેતા/પસંદગી પામીશ તો સ્પર્ધા સ્થળે મારા ખર્ચે અને જોખમે દર્શાવેલ સમય કરતાં પહેલાં ઉપસ્થિત રહીશ.
- વ્યક્તિગત રમતની સબ ઈવેન્ટ માટે પાછળના પૃષ્ઠ પર આપેલ ઈવેન્ટમાં નું નિશાન કરવું
- વ્યક્તિગત રમત માટે ફોર્મ-અ અને સાંધિક રમત માટે ફોર્મ-અ અને ફોર્મ-બ ભરવું ફરજિયાત છે
- ટેબલ ટેનીસ, લોન ટેનીસ, બેડમીન્ટન ડબલ્સ અને મિક્સ ડબલ્સ માટે ફોર્મ-બ ભરવાનું રહેશે
- જે સ્પર્ધા જિલ્લાકક્ષા/રાજ્યકક્ષાએ સીધી શરૂ થાય છે તેમાં ભાગ લેનાર ખેલાડીઓએ સ્પર્ધા શરૂ થવાના દિન-૭ પહેલાં પોતાના જિલ્લાના જિલ્લા રમત ગમત અધિકારીને પોતાના નામ અને રમતની યાદી જન્મના પુરાવા સાથે રજૂ કરવાની રહેશે
- કોવિડ-૧૯ ની સરકારશ્રીની વખતોવખતની ગાઇડલાઇનની શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે

તા. ___/___/૨૦૨૨

સ્થળ:- _____

ખેલાડીની સહી

સાંઘિક રમત માટે ટીમની યાદીનું પ્રવેશ પત્ર
(કોઈ પણ એક જ રમતમાં ભાગ લઈ શકાશે)

૧. ટીમનું નામ/શાળાનું નામ /
કોલેજ/સંસ્થાનું નામ
ડબલ્સ અને મિક્સ ડબલ્સ
માટેના નામ

પ્રથમ પાર્ટનરનું નામ	બીજા પાર્ટનરનું નામ

૨. રમતનું નામ

૩. સંપર્ક નંબર

૪. ખેલાડીના નામ

અટક નામ પિતાનું નામ

૧. _____

૨. _____

૩. _____

૪. _____

૫. _____

૬. _____

૭. _____

૮. _____

૯. _____

૧૦. _____

૧૧. _____

૧૨. _____

૧૩. _____

૧૪. _____

૧૫. _____

૧૬. _____

બાહેધરી:-

- સ્પર્ધા દરમિયાન કોઈ પણ જાતની શારીરિક હાની થશે તો તેની જવાબદારી મારી અને મારા વાલીની રહેશે. આયોજકની કોઈ જવાબદારી રહેશે નહીં.
- હું રજિસ્ટ્રેશન સમગ્ર રાજ્યમાંથી ફક્ત એકજ સ્થળેથી કરીશ અન્યથા મારું રજિસ્ટ્રેશન રદબાતલ ગણાશે.
- હું _____ આથી બાહેધરી આપુ છું કે જો હું ખેલમહાકુંભમાં વિજેતા/પસંદગી પામીશ તો સ્પર્ધા સ્થળે મારા ખર્ચે અને જોખમે દર્શાવેલ સમય કરતાં પહેલાં ઉપસ્થિત રહીશ.
- દરેક સાંઘિક જ રમત માટે ફોર્મ-અ અને ફોર્મ-બ ભરવું ફરજિયાત છે.
- કોવિડ-૧૯ ની સરકારશ્રીની વખતોવખતની ગાઇડલાઇનની શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

તા. ___/___/૨૦૨૨

સ્થળ:- _____

વેબસાઇટ: khelmahakumbh.gujarat.gov.in

ખેલાડીની સહી



ખેલમહાકુંભ (૨મતોની યાદી)



અંક ૨૧ (૧૧ વર્ષથી નીચેના) (તા.૦૧.૦૧.૨૦૧૧ અને તે પછી જન્મેલા)

(જે રમતમાં ભાગ લેવાનો હોય તેની સામે કરવી (એક જ રમતમાં ભાગ લઈ શકશે)

સીધી શાળા કક્ષાથી શરૂ થતી સ્પર્ધા

એથલેટીક્સ ૫૦ મીટર સ્ટેન્ડીંગ બોલ જમ્પ

અંક ૨૪ (૧૪ વર્ષથી નીચેના) (તા.૦૧.૦૧.૨૦૦૮ પછી જન્મેલા)

સીધી શાળા કક્ષાથી શરૂ થતી સ્પર્ધા

એથલેટીક્સ ૧૦૦મીટર લાંબીકૂદ ગોળા ફેંક

વોલીબોલ વોલીબોલ

ખો-ખો ખો-ખો

કબડ્ડી ભાઈઓ (૫૧ કિગ્રા) બહેનો (૪૮ કિગ્રા)

નોંધ:-યોગાસન માટે,

- > ગુ ૫A પશ્ચિમોતાસન,સર્વાંગાસન,મસ્ત્યાસન,અર્ધમસ્ત્યાસન,પુર્ણ ધનુ રાસન, ઉત્તાન પાદાસન
- > ગુ ૫B પુર્ણ ચક્રાસન,કુકુટાસન, ભુમાસન,પુર્ણસલાભાસન, બકાસન, સિર્ષાસન
- > ગુ ૫ C સાંખ્યાસન, વ્યાપ્રાસન, ઉર્ધ્વ કુકુટાસન, ઉત્તિચતિતિવાસન, પદ્મ મધુ રાસન,ઉત્તિચપાદકસ્થાસન
- > રાજ્યકક્ષાએ બેસ્ટ એક ધ બેસ્ટ રમાશે.

સીધી તાલુકા/ઝોન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા

એથલેટીક્સ ૨૦૦ મીટર ૪૦૦ મીટર ૬૦૦ મીટર ઉર્ધ્વકૂદ ચક્રફેંક

ચેસ ચેસ

યોગાસન વ્યક્તિગત યોગા ચેમ્પિયનશીપ (ગુ પ A, B, C અને મનપસંદગીના આસનો)

સીધી જિલ્લા/કોર્પોરેશનકક્ષાથી શરૂ થતી સ્પર્ધા

યોગાસન આર્થિસ્ટિક યોગા(ટ્રેડિશનલ) રિધમીક યોગા

આર્ચરી ઇન્ડિયન રાઉન્ડ (વ્યક્તિગત એવરઓલ)

સ્વીમીંગ ૧૦૦ મી.ફી સ્ટાઈલ બેક સ્ટ્રોક ૧૦૦ મી બટર ફ્લાય સ્ટ્રોક ૧૦૦ મી

૪૦૦ મી.ફી સ્ટાઈલ બેસ્ટ સ્ટ્રોક ૧૦૦ મી વ્યક્તિગત મીડલે ૨૦૦ મી

સ્કેટીંગ ક્વોડ રીક ૧ (૫૦૦ મી.) રીક ૨ (૧૦૦૦ મી.)

ઈનલાઈન રીક ૩ (૫૦૦ મી.) રીક ૪ (૧૦૦૦ મી.)

જુડો ભાઈઓ ૨૫ કિગ્રા સુ ધી ૨૫-૩૦ કિગ્રા ૩૦-૩૫ કિગ્રા ૩૫-૪૦ કિગ્રા

બહેનો ૨૩ કિગ્રા સુ ધી ૨૩-૨૭ કિગ્રા ૨૭-૩૨ કિગ્રા ૩૨-૩૬ કિગ્રા

કુસ્તી ભાઈઓ ૩૦-૩૫ કિગ્રા ૩૫-૩૮ કિગ્રા ૩૮-૪૧ કિગ્રા ૪૧-૪૪ કિગ્રા ૪૪-૪૮ કિગ્રા

બહેનો ૨૬-૩૦ કિગ્રા ૩૦-૩૩ કિગ્રા ૩૩-૩૬ કિગ્રા ૩૬-૩૯ કિગ્રા ૩૯-૪૨ કિગ્રા

ટેકવેન્ડો ભાઈઓ ૧૮ કિગ્રા સુ ધી ૧૮-૨૧ કિગ્રા ૨૩-૨૫ કિગ્રા ૨૭-૨૯ કિગ્રા

બહેનો ૧૬ કિગ્રા સુ ધી ૧૮-૨૦ કિગ્રા ૨૨-૨૪ કિગ્રા ૨૬-૨૮ કિગ્રા

બેડમીન્ટન સીંગલ્સ

બાસ્કેટબોલ બાસ્કેટબોલ

ટેબલ ટેનીસ સીંગલ્સ

લોન ટેનીસ સીંગલ્સ

હેન્ડબોલ હેન્ડબોલ

હોકી હોકી

ફુટબોલ ફુટબોલ

કરાટે ભાઈઓ ૨૦ કિગ્રા સુ ધી ૨૦-૨૫ કિગ્રા ૨૫-૩૦ કિગ્રા ૩૦-૩૫ કિગ્રા ૩૫-૪૦ કિગ્રા ૪૦-૪૫ કિગ્રા ૪૫-૫૦ કિગ્રા ૫૦-૫૫ કિગ્રા ૫૫-૬૦ કિગ્રા ૬૦ કિગ્રાથી ઉપર

બહેનો ૧૮ કિગ્રા સુ ધી ૧૮-૨૨ કિગ્રા ૨૨-૨૪ કિગ્રા ૨૪-૨૬ કિગ્રા ૨૬-૩૦ કિગ્રા ૩૦-૩૪ કિગ્રા ૩૪-૪૨ કિગ્રા ૪૨-૪૬ કિગ્રા ૪૬-૫૦ કિગ્રા ૫૦ કિગ્રાથી ઉપર

સીધી રાજ્ય કક્ષાથી શરૂ થતી સ્પર્ધા

આર્થિસ્ટીક સ્કેટીંગ ફ્રી સ્કેટીંગ સોલોડાન્સ ડ્રીગર ક્વોટેટ

એથલેટીક્સ ૮૦ મી હર્ડલ્સ ૪ X ૧૦૦ મી રીલે

સ્વીમીંગ ફ્રી સ્ટાઈલ ૫૦મી ફ્રી સ્ટાઈલ ૨૦૦મી ફ્રી સ્ટાઈલ રીલે ૪ X ૧૦૦મી બેક સ્ટ્રોક ૫૦ મી બેક સ્ટ્રોક ૨૦૦ મી મીડલે રીલે ૪ X ૧૦૦મી

બેસ્ટ સ્ટ્રોક ૫૦ મી બેસ્ટ સ્ટ્રોક ૨૦૦મી બટર ફ્લાય સ્ટ્રોક ૫૦ મી બટરફ્લાય સ્ટ્રોક ૨૦૦મી

જુડો ભાઈઓ ૪૦-૪૫ કિગ્રા ૪૫-૫૦ કિગ્રા ૫૦ કિગ્રા થી ઉપર

બહેનો ૩૬-૪૦ કિગ્રા ૪૦-૪૪ કિગ્રા ૪૪ કિગ્રા થી ઉપર

કુસ્તી ભાઈઓ ૪૮-૫૨ કિગ્રા ૫૨-૫૭ કિગ્રા ૫૭-૬૨ કિગ્રા ૬૨-૬૮ કિગ્રા ૬૮-૭૫ કિગ્રા

બહેનો ૪૨-૪૬ કિગ્રા ૪૬-૫૦ કિગ્રા ૫૦-૫૪ કિગ્રા ૫૪-૫૮ કિગ્રા ૫૮-૬૨ કિગ્રા

ટેકવેન્ડો ભાઈઓ ૨૧-૨૩ કિગ્રા ૨૫-૨૭ કિગ્રા ૨૯-૩૨ કિગ્રા ૩૨-૩૫ કિગ્રા ૩૫-૩૮ કિગ્રા ૩૮-૪૧ કિગ્રા ૪૧ કિગ્રાથી ઉપર

બહેનો ૧૬-૧૮ કિગ્રા ૨૦-૨૨ કિગ્રા ૨૪-૨૬ કિગ્રા ૨૯-૩૨ કિગ્રા ૩૨-૩૫ કિગ્રા ૩૫-૩૮ કિગ્રા ૩૮ કિગ્રાથી ઉપર

જીમ્નાસ્ટીક ભાઈઓ ફ્લોર એક્સાઈઝ વોલ્ટીંગ ટેબલ રોમનરોંગ પેરલલબાર પોમ્પેલહોર્સ હોરિજોન્ટલબાર

બહેનો ફ્લોર એક્સાઈઝ વોલ્ટીંગ ટેબલ બેલેસીંગબીમ અનઈવનબાર હૂપ(રિધમીક) ક્લબ(રિધમીક) બોલ(રિધમીક) રોપ(રિધમીક) રીબન (રિધમીક)

સ્કેટીંગ ક્વોડ રોડ ૧ (૨૦૦૦ મી.)

ઈનલાઈન રોડ ૨ (૫૦૦ મી.) રોડ ૩ (૨૦૦૦ મી.)

આર્ચરી રીકર્વ રાઉન્ડ વ્યક્તિગત એવરઓલ વ્યક્તિગત એલિમીનેશન રાઉન્ડ ટીમ મીક્ષ ટીમ

કમ્પાઉન્ડ રાઉન્ડ વ્યક્તિગત એવરઓલ વ્યક્તિગત એલિમીનેશન રાઉન્ડ ટીમ મીક્ષ ટીમ

શુટીંગ ૧૦ મી.એર પીસ્તોલ ૧૦ મી.પીપ સાઈટ એર રાયફલ ૧૦ મી. ઓપન સાઈટ એર રાયફલ (વ્યક્તિગત)

ટેન્સીંગ ક્ષેત્ર ઈપી સેબર

બોક્સીંગ ભાઈઓ ૨૮-૩૦ કિગ્રા ૩૦-૩૨ કિગ્રા ૩૨-૩૪ કિગ્રા ૩૪-૩૬ કિગ્રા ૩૬-૩૮ કિગ્રા ૩૮-૪૦ કિગ્રા ૪૦-૪૨ કિગ્રા ૪૨-૪૪ કિગ્રા ૪૪-૪૬ કિગ્રા ૪૬-૪૮ કિગ્રા ૪૮-૫૦ કિગ્રા

નોંધ:- શાળાકક્ષાથી રાજ્યકક્ષા સુધીની સ્પર્ધા માટે

- > યોગાસનમાં ખેલાડી દ્વારા વધુમાં વધુ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે
- > બે ઇવેન્ટમાં ભાગ લેવા માટે વ્યક્તિગત યોગા ચેમ્પિયનશીપ ઇવેન્ટની પસંદગી કરવાની ફરજિયાત રહેશે
- > એથલેટીક્સ રમતમાં વધુ માં વધુ ઇવેન્ટ અને ૧ રીલે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.
- > સ્વીમીંગ રમતમાં વધુમાં વધુ ઇવેન્ટ અને ૨ રીલેમાં ભાગ લઈ શકશે.
- > જિલ્લાકક્ષા અને રાજ્યકક્ષાએ સ્કેટીંગમાં ક્વોડ અથવા ઇનલાઈન બેમાંથી એક ઇવેન્ટમાં ભાગ લઈ શકશે
- > કુસ્તી, ટેકવેન્ડો, બોક્સીંગ, કરાટે અને જુડોની રમતમાં કોઈ પણ એક વજન ગ્રુપમાં ભાગ લઈ શકશે.
- > કુસ્તી, ટેકવેન્ડો, અને જુડોની રમતમાં કોઈ પણ એક વજન ગ્રુપમાં ભાગ લઈ શકશે.

> જીમ્નાસ્ટીક સ્પર્ધામાં ખેલાડી કોઈ પણ બે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે

> જીમ્નાસ્ટીક સ્પર્ધામાં SGFના નિયમ પ્રમાણે ભાઈઓએ ૬ (પેરા) રમત અને બહેનોએ ૪ (ચાર) પેરા રમતમાં ભાગ લેવાનો રહેશે

> શુટીંગ સ્પર્ધામાં સ્પર્ધકોએ શુટીંગ માટે ખોતાની રાઈફલ લાવવાની રહેશે. ત્રણમાંથી કોઈ પણ બે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે

> શુટીંગ સ્પર્ધામાં એર પીસ્તોલની એક અથવા એર રાયફલ બે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે



ખેલમહાકુંભ (રમતોની યાદી)



અંક ૨ ૧૭ (૧૭ વર્ષથી નીચેના) (૧.૧.૨૦૦૫ પછી જન્મેલા)

જે રમતમાં ભાગ લેવાનો હોય તેની સામે કરવી (એક જ રમતમાં ભાગ લઈ શકશે)

સીધી શાળા કક્ષાથી શરૂ થતી સ્પર્ધા

એથલેટીક્સ	<input type="checkbox"/> ૧૦૦ મી	<input type="checkbox"/> લાંબીકૂદ	<input type="checkbox"/> લંગડીજાન કુદ	<input type="checkbox"/> ગોળાકેક
રસ્સાપેચ	<input type="checkbox"/> ભાઈઓ ૪૮૦ કિગ્રા	<input type="checkbox"/> બહેનો ૪૦૦ કિગ્રા	નોંધ: (૮ ખેલાડીઓનું કુલ વજન)	
વોલીબોલ	<input type="checkbox"/> વોલીબોલ			
બો-બો	<input type="checkbox"/> બો-બો			
કબડ્ડી	<input type="checkbox"/> ભાઈઓ (૫૫ કિગ્રા) <input type="checkbox"/> બહેનો (૫૫ કિગ્રા)			

સીધી તાલુકા/ઝોન/કક્ષાથી શરૂ થતી સ્પર્ધા

એથલેટીક્સ	<input type="checkbox"/> ૨૦૦મી <input type="checkbox"/> ૪૦૦મી <input type="checkbox"/> ૮૦૦ મી <input type="checkbox"/> ૧૫૦૦ મી	<input type="checkbox"/> ઉચ્ચકૂદ <input type="checkbox"/> બરછીકેક <input type="checkbox"/> ચક્રકેક
ચેસ	<input type="checkbox"/> ચેસ	
યોગાસન	<input type="checkbox"/> વ્યક્તિગત યોગા ચેમ્પિયનશીપ (ગ્રુપ A, B, C અને મનપસંદગીના આસનો)	

નોંધ: યોગાસન માટે,
 > ગ્રુપ A પશ્ચિમીયાસન, સર્વોચ્ચાસન, મન્યાસન, અર્ધમન્યાસન, પુર્ણ ધનુસાસન ઉત્તાન પદાસન
 > ગ્રુપ B પુર્ણ ચક્રાસન, કુચાસન ભુ માસનપુ વ્રજાસન, બકાસન, શિર્ષાસન
 > ગ્રુપ C સાંધ્યાસન, વ્યાધાસન, ઉર્ધ્વ કુક્રાસન ઉત્તિશ્ચિતિવાસન, પદ્મ મયુ રાસનઉત્તિશ્ચાપદાસન
 > રાજ્યકક્ષાએ બેસ્ટ ઓફ ધ બેસ્ટ રમાશે.

સીધી જિલ્લા/કોર્પોરેશન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા

આર્ચરી	<input type="checkbox"/> ઇન્ડિયન રાઉન્ડ (વ્યક્તિગત ઓવરશોલ)	
યોગાસન	<input type="checkbox"/> આર્થોસ્ટિક યોગા (ટ્રેડિશનલ) <input type="checkbox"/> રિધમીક યોગા	
સ્વીમીંગ	<input type="checkbox"/> ૧૦૦ મી ફ્રી સ્ટાઇલ	<input type="checkbox"/> બેક સ્ટ્રોક ૧૦૦ મી <input type="checkbox"/> બટર ફ્લાય સ્ટ્રોક ૧૦૦ મી
	<input type="checkbox"/> ૪૦૦ મી ફ્રી સ્ટાઇલ	<input type="checkbox"/> બેસ્ટ સ્ટ્રોક ૧૦૦ મી <input type="checkbox"/> વ્યક્તિગત મીડલે ૨૦૦ મી
સ્કેટીંગ	ક્યોડ	<input type="checkbox"/> રીક ૧ (૫૦૦ મી.) <input type="checkbox"/> રીક ૨ (૧૦૦૦ મી.)
	ઇનલાઇન	<input type="checkbox"/> રીક ૩ (૫૦૦ મી.) <input type="checkbox"/> રીક ૪ (૧૦૦૦ મી.)
જુડો	ભાઈઓ	<input type="checkbox"/> ૪૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૪૦-૪૫ કિગ્રા <input type="checkbox"/> ૪૫-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦-૫૫ કિગ્રા <input type="checkbox"/> ૫૫-૬૦ કિગ્રા
	બહેનો	<input type="checkbox"/> ૩૬ કિગ્રા સુધી <input type="checkbox"/> ૩૬-૪૦ કિગ્રા <input type="checkbox"/> ૪૦-૪૪ કિગ્રા <input type="checkbox"/> ૪૪-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૨ કિગ્રા
કુસ્તી	ભાઈઓ-ફ્રીસ્ટાઇલ	<input type="checkbox"/> ૪૧-૪૫ કિગ્રા <input type="checkbox"/> ૪૫-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૧ કિગ્રા <input type="checkbox"/> ૫૧-૫૫ કિગ્રા <input type="checkbox"/> ૫૫-૬૦ કિગ્રા
	બહેનો-ફ્રીસ્ટાઇલ	<input type="checkbox"/> ૩૬-૪૦ કિગ્રા <input type="checkbox"/> ૪૦-૪૩ કિગ્રા <input type="checkbox"/> ૪૩-૪૬ કિગ્રા <input type="checkbox"/> ૪૬-૪૯ કિગ્રા <input type="checkbox"/> ૪૯-૫૩ કિગ્રા
ટેકવેન્ડો	ભાઈઓ	<input type="checkbox"/> ૩૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૩૫-૩૮ કિગ્રા <input type="checkbox"/> ૪૧-૪૫ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૧ કિગ્રા <input type="checkbox"/> ૫૫-૫૯ કિગ્રા <input type="checkbox"/> ૭૮ કિગ્રા થી ઉપર
	બહેનો	<input type="checkbox"/> ૩૨ કિગ્રા સુધી <input type="checkbox"/> ૩૮-૪૨ કિગ્રા <input type="checkbox"/> ૪૪-૪૬ કિગ્રા <input type="checkbox"/> ૫૨-૫૫ કિગ્રા <input type="checkbox"/> ૬૮ કિગ્રા થી ઉપર
બેડમીન્ટન	<input type="checkbox"/> સીંગલ્સ	
બાસ્કેટબોલ	<input type="checkbox"/> બાસ્કેટબોલ	
ટેબલ ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ	
લોન ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ	
હેન્ડબોલ	<input type="checkbox"/> હેન્ડબોલ	
હોકી	<input type="checkbox"/> હોકી	
કુટબોલ	<input type="checkbox"/> કુટબોલ	
કરાટે	ભાઈઓ	<input type="checkbox"/> ૩૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૩૫-૪૦ કિગ્રા <input type="checkbox"/> ૪૦-૪૫ કિગ્રા <input type="checkbox"/> ૪૫-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦-૫૪ કિગ્રા <input type="checkbox"/> ૫૪-૫૮ કિગ્રા <input type="checkbox"/> ૫૮-૬૨ કિગ્રા <input type="checkbox"/> ૬૨-૬૬ કિગ્રા <input type="checkbox"/> ૬૬-૭૦ કિગ્રા <input type="checkbox"/> ૭૦-૭૪ કિગ્રા
	બહેનો	<input type="checkbox"/> ૩૨ કિગ્રા સુધી <input type="checkbox"/> ૩૨-૩૬ કિગ્રા <input type="checkbox"/> ૩૬-૪૦ કિગ્રા <input type="checkbox"/> ૪૦-૪૪ કિગ્રા <input type="checkbox"/> ૪૪-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૨ કિગ્રા <input type="checkbox"/> ૫૨-૫૬ કિગ્રા <input type="checkbox"/> ૫૬-૬૦ કિગ્રા <input type="checkbox"/> ૬૦-૬૪ કિગ્રા <input type="checkbox"/> ૬૪-૬૮ કિગ્રા <input type="checkbox"/> ૬૮ થી ઉપર

નોંધ: શાળાકક્ષાથી રાજ્યકક્ષા સુધીની સ્પર્ધા માટે
 > યોગાસનમાં ખેલાડી દ્વારા વધુમાં વધુ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે
 > બે ઇવેન્ટમાં ભાગ લેવા માટે વ્યક્તિગત યોગા ચેમ્પિયનશીપ ઇવેન્ટની પસંદગી કરવાની ફરજિયાત રહેશે
 > યોગાસનમાં ખેલાડી દ્વારા વધુમાં વધુ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે
 > બે ઇવેન્ટમાં ભાગ લેવા માટે વ્યક્તિગત યોગા ચેમ્પિયનશીપ ઇવેન્ટની પસંદગી કરવાની ફરજિયાત રહેશે
 > એથલેટીક્સ રમતમાં વધુમાં વધુ ઇવેન્ટ અને ૧ રીલે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે
 > સ્વીમીંગ રમતમાં વધુમાં વધુ ઇવેન્ટ અને ૨ રીલેમાં ભાગ લઈ શકશે
 > જિલ્લાકક્ષા અને રાજ્યકક્ષાએ સ્કેટીંગમાં ક્યોડ અથવા ઇનલાઇન બેમાંથી એક ઇવેન્ટમાં ભાગ લઈ શકશે
 > કુસ્તી, ટેકવેન્ડો, બોક્સિંગ, કરાટે અને જુડોની રમતમાં કોઈ પણ એક વજન ગ્રુપમાં ભાગ લઈ શકશે

સીધી રાજ્ય કક્ષાથી શરૂ થતી સ્પર્ધા

એથલેટીક્સ	<input type="checkbox"/> ૩૦૦૦ મી <input type="checkbox"/> ૧૦૦ મી હર્ડલ્સ <input type="checkbox"/> ૪ X ૧૦૦ મી રીલે <input type="checkbox"/> વાંસકૂદ <input type="checkbox"/> હથોડા ફેક <input type="checkbox"/> ૫ કી.મી.વોક(ભાઈઓ) <input type="checkbox"/> ૩ કી.મી.વોક(બહેનો)	
સ્વીમીંગ	<input type="checkbox"/> ફ્રીસ્ટાઇલ ૫૦મી <input type="checkbox"/> બેક સ્ટ્રોક ૨૦૦ મી <input type="checkbox"/> બેસ્ટ સ્ટ્રોક ૨૦૦ મી <input type="checkbox"/> બટરફ્લાય સ્ટ્રોક ૨૦૦મી <input type="checkbox"/> ફ્રી સ્ટાઇલ ૮૦૦મી (ભાઈઓ)	<input type="checkbox"/> વ્યક્તિગત મીડલે ૪૦૦ મી <input type="checkbox"/> ફ્રીસ્ટાઇલ ૨૦૦મી <input type="checkbox"/> બેક સ્ટ્રોક ૫૦મી <input type="checkbox"/> ફ્રીસ્ટાઇલ રીલે ૪ X ૧૦૦ મી <input type="checkbox"/> બેસ્ટ સ્ટ્રોક ૫૦ મી
	<input type="checkbox"/> બટર ફ્લાય ૫૦મી <input type="checkbox"/> મીડલે રીલે ૪ X ૧૦૦ મી	
જુડો	ભાઈઓ	<input type="checkbox"/> ૬૦-૬૬ કિગ્રા <input type="checkbox"/> ૬૬-૭૩ કિગ્રા <input type="checkbox"/> ૭૩-૮૧ કિગ્રા <input type="checkbox"/> ૮૧-૯૦ કિગ્રા <input type="checkbox"/> ૯૦ કિગ્રા થી ઉપર
	બહેનો	<input type="checkbox"/> ૫૨-૫૭ કિગ્રા <input type="checkbox"/> ૫૭-૬૩ કિગ્રા <input type="checkbox"/> ૬૩-૭૦ કિગ્રા <input type="checkbox"/> ૭૦ કિગ્રા થી ઉપર
કુસ્તી	ભાઈઓ (ફ્રીસ્ટાઇલ)	<input type="checkbox"/> ૬૦-૬૫ કિગ્રા <input type="checkbox"/> ૬૫-૭૧ કિગ્રા <input type="checkbox"/> ૭૧-૮૦ કિગ્રા <input type="checkbox"/> ૮૦-૯૨ કિગ્રા <input type="checkbox"/> ૯૨-૧૧૦ કિગ્રા
	બહેનો (ફ્રીસ્ટાઇલ)	<input type="checkbox"/> ૫૩-૫૭ કિગ્રા <input type="checkbox"/> ૫૭-૬૧ કિગ્રા <input type="checkbox"/> ૬૧-૬૫ કિગ્રા <input type="checkbox"/> ૬૫-૬૯ કિગ્રા <input type="checkbox"/> ૬૯-૭૩ કિગ્રા
ટેકવેન્ડો	ભાઈઓ	<input type="checkbox"/> ૩૮-૪૧ કિગ્રા <input type="checkbox"/> ૪૫-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૫૧-૫૫ કિગ્રા <input type="checkbox"/> ૫૯-૬૩ કિગ્રા <input type="checkbox"/> ૬૩-૬૮ કિગ્રા <input type="checkbox"/> ૬૮-૭૩ કિગ્રા <input type="checkbox"/> ૭૩-૭૮ કિગ્રા
	બહેનો	<input type="checkbox"/> ૩૨-૩૫ કિગ્રા <input type="checkbox"/> ૩૫-૩૮ કિગ્રા <input type="checkbox"/> ૪૨-૪૪ કિગ્રા <input type="checkbox"/> ૪૬-૪૯ કિગ્રા <input type="checkbox"/> ૪૯-૫૨ કિગ્રા <input type="checkbox"/> ૫૫-૫૯ કિગ્રા <input type="checkbox"/> ૫૯-૬૩ કિગ્રા <input type="checkbox"/> ૬૩-૬૮ કિગ્રા
જીમ્નાસ્ટીક	ભાઈઓ	<input type="checkbox"/> ફ્લોર એક્સાઇઝ <input type="checkbox"/> વોલ્ટીંગ ટેબલ <input type="checkbox"/> રોમનરીંગ <input type="checkbox"/> પેરલલબાર <input type="checkbox"/> પોમલક્લોસ <input type="checkbox"/> હોરિજન્ટલબાર
	બહેનો	<input type="checkbox"/> ફ્લોર એક્સાઇઝ <input type="checkbox"/> વોલ્ટીંગ ટેબલ <input type="checkbox"/> બેલેસીંગબીમ <input type="checkbox"/> અનઇવનબાર <input type="checkbox"/> હૂપ(રિધમીક) <input type="checkbox"/> ક્લબ(રિધમીક) <input type="checkbox"/> બોલ(રિધમીક) <input type="checkbox"/> રોપ(રિધમીક) <input type="checkbox"/> રીબન (રિધમીક)
સ્કેટીંગ	ક્યોડ	<input type="checkbox"/> રોડ રેસ ૩ (૩૦૦૦ મી.)
	ઇનલાઇન	<input type="checkbox"/> રોડ રેસ ૨ (૫૦૦ મી.) <input type="checkbox"/> રોડ રેસ ૩ (૩૦૦૦ મી.)

> જીમ્નાસ્ટીક સ્પર્ધામાં ખેલાડી કોઈ પણ બે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે
 > જીમ્નાસ્ટીક સ્પર્ધામાં SOFના નિયમ પ્રમાણે ભાઈઓએ ૬ (છ) પેરા રમત અને બહેનોએ ૫ (પાંચ) પેરા રમતમાં ભાગ લેવાનો રહેશે

આર્ચરી	રીકર્વ રાઉન્ડ <input type="checkbox"/> વ્યક્તિગત ઓવરશોલ <input type="checkbox"/> વ્યક્તિગત એલિમીનેશન રાઉન્ડ <input type="checkbox"/> ટીમ <input type="checkbox"/> મીક્સ ટીમ	
શુટીંગ	કમ્પાઉન્ડ રાઉન્ડ <input type="checkbox"/> વ્યક્તિગત ઓવરશોલ <input type="checkbox"/> વ્યક્તિગત એલિમીનેશન રાઉન્ડ <input type="checkbox"/> ટીમ <input type="checkbox"/> મીક્સ ટીમ	
	<input type="checkbox"/> ૧૦ મી.એર પીસ્ટોલ <input type="checkbox"/> ૧૦ મી.પીપ સાઇટ એર રાયફલ <input type="checkbox"/> ૧૦ મી. ઓપન સાઇટ એર રાયફલ (વ્યક્તિગત)	
વેઇટલિફ્ટીંગ	ભાઈઓ	<input type="checkbox"/> ૪૬ કિગ્રા સુધી <input type="checkbox"/> ૫૫ કિગ્રા <input type="checkbox"/> ૬૧ કિગ્રા <input type="checkbox"/> ૬૭ કિગ્રા <input type="checkbox"/> ૭૩ કિગ્રા <input type="checkbox"/> ૮૧ કિગ્રા <input type="checkbox"/> ૯૬ કિગ્રા <input type="checkbox"/> ૧૦૨ કિગ્રા <input type="checkbox"/> ૧૦૨ કિગ્રા થી ઉપર
	બહેનો	<input type="checkbox"/> ૪૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૪૫ કિગ્રા <input type="checkbox"/> ૪૯ કિગ્રા <input type="checkbox"/> ૫૫ કિગ્રા <input type="checkbox"/> ૫૯ કિગ્રા <input type="checkbox"/> ૬૪ કિગ્રા <input type="checkbox"/> ૭૧ કિગ્રા <input type="checkbox"/> ૭૬ કિગ્રા <input type="checkbox"/> ૮૧ કિગ્રા <input type="checkbox"/> ૮૧ કિગ્રા થી ઉપર
ફેન્સીંગ	<input type="checkbox"/> ફોઇલ <input type="checkbox"/> ઈપી <input type="checkbox"/> સેબર	
બોક્સિંગ	ભાઈઓ	<input type="checkbox"/> ૪૬ કિગ્રા સુધી <input type="checkbox"/> ૪૬-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦-૫૨ કિગ્રા <input type="checkbox"/> ૫૨-૫૪ કિગ્રા <input type="checkbox"/> ૫૪-૫૭ કિગ્રા <input type="checkbox"/> ૫૭-૬૦ કિગ્રા
	બહેનો	<input type="checkbox"/> ૬૦-૬૩ કિગ્રા <input type="checkbox"/> ૬૩-૬૬ કિગ્રા <input type="checkbox"/> ૬૬-૭૦ કિગ્રા <input type="checkbox"/> ૭૦-૭૫ કિગ્રા <input type="checkbox"/> ૭૫-૮૦ કિગ્રા <input type="checkbox"/> ૮૦ કિગ્રા થી ઉપર
બોક્સિંગ	ભાઈઓ	<input type="checkbox"/> ૪૨ કિગ્રા સુધી <input type="checkbox"/> ૪૨-૪૪ કિગ્રા <input type="checkbox"/> ૪૪-૪૬ કિગ્રા <input type="checkbox"/> ૪૬-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦-૫૨ કિગ્રા
	બહેનો	<input type="checkbox"/> ૫૨-૫૪ કિગ્રા <input type="checkbox"/> ૫૪-૫૭ કિગ્રા <input type="checkbox"/> ૫૭-૬૦ કિગ્રા <input type="checkbox"/> ૬૦-૬૩ કિગ્રા <input type="checkbox"/> ૬૩-૬૬ કિગ્રા <input type="checkbox"/> ૬૬-૭૦ કિગ્રા <input type="checkbox"/> ૭૦-૭૫ કિગ્રા <input type="checkbox"/> ૭૫-૮૦ કિગ્રા <input type="checkbox"/> ૮૦ થી ઉપર

> શુટીંગ સ્પર્ધામાં સ્પર્ધાક્રમે શુટીંગ માટે પોતાની રાઇફલ લાવવાની રહેશે ત્રણમાંથી કોઈ પણ બે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.
 > શુટીંગ સ્પર્ધામાં એર પીસ્ટોલની એક અથવા એર રાયફલ બે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે

ઓપન એઈજ ગ્રુપ (૧૭ થી ૪૫ વર્ષ સુધી) (૦૧.૦૧.૧૯૭૭ થી તા.૩૧/૧૨/૨૦૦૪ દરમ્યાન જન્મેલા)

જે રમતમાં ભાગ લેવાનો હોય તેની સામે ✓ કરવી (એક જ રમતમાં ભાગ લઈ શકશે)

❖ સીધી ગ્રામ્ય કક્ષાએથી શરૂ થતી સ્પર્ધા ❖

એથલેટીક્સ	<input type="checkbox"/> ૧૦૦ મી. <input type="checkbox"/> લાંબીફૂદ <input type="checkbox"/> લાંઘડીફૂદ <input type="checkbox"/> ગોળાફૂક
રસ્સાખેંચ	<input type="checkbox"/> ભાઈઓ ૫૨૦ કિગ્રા <input type="checkbox"/> બહેનો ૪૪૦ કિગ્રા નોંધ: (૮ ખેલાડીઓનું કુલ વજન)
વોલીબોલ	<input type="checkbox"/> વોલીબોલ
કબડ્ડી	<input type="checkbox"/> ભાઈઓ (૮૫ કિગ્રા) <input type="checkbox"/> બહેનો (૭૫ કિગ્રા)
ખો-ખો	<input type="checkbox"/> ખો-ખો

નોંધ:- યોગાસન માટે,
 ➢ ગુ.પ.૫.A પશ્ચિમોત્તાસન, સર્વંગાસન, મત્સ્યાસન, અર્ધમત્સ્યાસન, પુષ્પ પુષ્પ ધનુરસન ઉત્તાન પાદાસન
 ➢ ગુ.પ.૫.બી પુષ્પ ચક્રાસન, કુકુટાસન, ભુમાસન, પુષ્પાસન, બકાસન, શિર્ષાસન
 ➢ ગુ.પ.૫.સી સોખ્યાસન, વ્યાધાસન, ઉર્ધ્વ કુકુટાસન, ઉત્તિથિતિવ્યાસન, પદ્મ મયુરસન, ઉત્તિથિતિપાદહસ્તાસન
 ➢ રાજ્યકક્ષાએ બેસર થોડ ધ બેસર રમાશે

❖ સીધી તાલુકા / ઝોનકક્ષાએથી શરૂ થતી સ્પર્ધા ❖

એથલેટીક્સ	<input type="checkbox"/> ૨૦૦મી <input type="checkbox"/> ૪૦૦મી <input type="checkbox"/> ૮૦૦ મી <input type="checkbox"/> ૧૫૦૦ મી. <input type="checkbox"/> ૩૦૦૦ મી <input type="checkbox"/> ઉર્ચીકુદ <input type="checkbox"/> બરછીફૂક <input type="checkbox"/> ચક્રફૂક
ચેસ	<input type="checkbox"/> ચેસ
યોગાસન	<input type="checkbox"/> વ્યક્તિગત યોગા ચેમ્પિયનશીપ (ગ્રુપ A, B, C અને મનપસંદગીના આસનો)

❖ સીધી જિલ્લા/કોર્પોરેશન કક્ષાએથી શરૂ થતી સ્પર્ધા ❖

શુટીંગ બોલ	<input type="checkbox"/> ફક્ત ભાઈઓ માટે	
બેડમીન્ટન	<input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબલ્સ <input type="checkbox"/> મિક્સ ડબલ્સ	
યોગાસન	<input type="checkbox"/> આઈસ્ટિક યોગા (ટ્રેડિશનલ) <input type="checkbox"/> રિધમીક યોગા (નોંધ:- યોગાસનમાં ખેલાડી બાર વધુમાં વધુર ઇવેન્ટમાં ભાગ લઈ શકશે)	
કુટબોલ	<input type="checkbox"/> કુટબોલ	
બાસ્કેટબોલ	<input type="checkbox"/> બાસ્કેટબોલ	
ટેબલ ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબલ્સ <input type="checkbox"/> મિક્સ ડબલ્સ	
લોન ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબલ્સ <input type="checkbox"/> મિક્સ ડબલ્સ	
હેન્ડબોલ	<input type="checkbox"/> હેન્ડબોલ	
હોકી	<input type="checkbox"/> હોકી	
સ્વીમીંગ	<input type="checkbox"/> ૧૦૦ મી. ફ્રી સ્ટાઈલ <input type="checkbox"/> બેક સ્ટ્રોક ૧૦૦ મી <input type="checkbox"/> બટર ફ્લાય સ્ટ્રોક ૧૦૦ મી. <input type="checkbox"/> ૪૦૦ મી. ફ્રી સ્ટાઈલ <input type="checkbox"/> બ્રેસ્ટ સ્ટ્રોક ૧૦૦ મી <input type="checkbox"/> વ્યક્તિગત મીડલે ૨૦૦ મી.	
સ્કેટીંગ	સ્નોડ	<input type="checkbox"/> રીક ૧ (૫૦૦ મી.) <input type="checkbox"/> રીક ૨ (૧૦૦૦ મી.)
	ઈન લાઈન	<input type="checkbox"/> રીક ૩ (૫૦૦ મી.) <input type="checkbox"/> રીક ૪ (૧૦૦૦ મી.)
જુડો	ભાઈઓ	<input type="checkbox"/> ૫૫ કિગ્રા સુ ધી <input type="checkbox"/> ૫૫-૬૦ કિગ્રા <input type="checkbox"/> ૬૦-૬૬ કિગ્રા <input type="checkbox"/> ૬૬-૭૨ કિગ્રા
	બહેનો	<input type="checkbox"/> ૪૪ કિગ્રા સુ ધી <input type="checkbox"/> ૪૪-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૨ કિગ્રા <input type="checkbox"/> ૫૨-૫૭ કિગ્રા
કુસ્તી	ભાઈઓ	<input type="checkbox"/> ૪૬-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦-૫૭ કિગ્રા <input type="checkbox"/> ૫૭-૬૫ કિગ્રા <input type="checkbox"/> ૬૫-૭૦ કિગ્રા <input type="checkbox"/> ૭૦-૭૪ કિગ્રા
	બહેનો	<input type="checkbox"/> ૪૬-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦-૫૭ કિગ્રા <input type="checkbox"/> ૫૭-૬૫ કિગ્રા <input type="checkbox"/> ૬૫-૭૦ કિગ્રા <input type="checkbox"/> ૭૦-૭૪ કિગ્રા
ટેકવેન્ડો	ભાઈઓ	<input type="checkbox"/> ૪૫ કિગ્રા સુ ધી <input type="checkbox"/> ૪૫-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૫-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦-૬૦ કિગ્રા
	બહેનો	<input type="checkbox"/> ૪૦ કિગ્રા સુ ધી <input type="checkbox"/> ૪૦-૪૫ કિગ્રા <input type="checkbox"/> ૪૫-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦-૬૦ કિગ્રા
આર્યરી	<input type="checkbox"/> ઇન્ડિયન રાઉન્ડ (વ્યક્તિગત ઓવરથ્રોલ)	
કરાટે	ભાઈઓ	<input type="checkbox"/> ૩૫ કિગ્રા સુ ધી <input type="checkbox"/> ૩૫-૪૦ કિગ્રા <input type="checkbox"/> ૪૦-૪૫ કિગ્રા <input type="checkbox"/> ૪૫-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦-૫૪ કિગ્રા <input type="checkbox"/> ૫૪-૫૮ કિગ્રા <input type="checkbox"/> ૫૮-૬૨ કિગ્રા <input type="checkbox"/> ૬૨-૬૬ કિગ્રા <input type="checkbox"/> ૬૬-૭૦ કિગ્રા <input type="checkbox"/> ૭૦-૭૪ કિગ્રા
		<input type="checkbox"/> ૭૪-૭૮ કિગ્રા <input type="checkbox"/> ૭૮-૮૨ કિગ્રા <input type="checkbox"/> ૮૨ કિગ્રાથી ઉપર
	બહેનો	<input type="checkbox"/> ૩૨ કિગ્રા સુ ધી <input type="checkbox"/> ૩૨-૩૬ કિગ્રા <input type="checkbox"/> ૩૬-૪૦ કિગ્રા <input type="checkbox"/> ૪૦-૪૪ કિગ્રા <input type="checkbox"/> ૪૪-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૨ કિગ્રા <input type="checkbox"/> ૫૨-૫૬ કિગ્રા <input type="checkbox"/> ૫૬-૬૦ કિગ્રા <input type="checkbox"/> ૬૦-૬૪ કિગ્રા <input type="checkbox"/> ૬૪-૬૮ કિગ્રા <input type="checkbox"/> ૬૮ થી ઉપર

નોંધ:- શાળાકક્ષાથી રાજ્યકક્ષા સુ ધીની સ્પર્ધા માટે
 ➢ યોગાસનમાં ખેલાડી બાર વધુમાં વધુ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે
 ➢ બે ઇવેન્ટમાં ભાગ લેવા માટે વ્યક્તિગત યોગા ચેમ્પિયનશીપ ઇવેન્ટની પસંદગી કરવાની ફરજિયાત રહેશે
 ➢ એથલેટીક્સ રમતમાં વધુ માં વધુ ઇવેન્ટ અને ૧ રીલે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.
 ➢ સ્વીમીંગ રમતમાં વધુમાં વધુ ઇવેન્ટ અને ૨ રીલેમાં ભાગ લઈ શકશે
 ➢ જિલ્લાકક્ષા અને રાજ્યકક્ષાએ સ્કેટીંગમાં કવોડ અથવા ઇનલાઈન બેમાંથી એક ઇવેન્ટમાં ભાગ લઈ શકશે
 ➢ કુસ્તી, ટેકવેન્ડો, બોક્સીંગ, કરાટે અને જુડો રમતમાં કોઈ પણ એક વજન ગ્રુપમાં ભાગ લઈ શકશે
 ➢ બેડમીન્ટન, ટેબલ ટેનીસ અને ટેનીસ રમતમાં ૩ ઇવેન્ટમાંથી કોઈ પણ ૨ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે

❖ સીધી રાજ્ય કક્ષાએથી શરૂ થતી સ્પર્ધા ❖

એથલેટીક્સ	<input type="checkbox"/> ૫૦૦મી <input type="checkbox"/> ૧૧૦ મી હર્ડલ્સ ભાઈઓ <input type="checkbox"/> ૧૦૦ મી. હર્ડલ્સ (બહેનો) <input type="checkbox"/> ૪૦૦મી હર્ડલ્સ <input type="checkbox"/> ૪ X ૧૦૦મી. રીલે <input type="checkbox"/> ૪ X ૪૦૦ મી. રીલે <input type="checkbox"/> વાંસફૂદ <input type="checkbox"/> હથોડા ફૂક
સ્વીમીંગ	<input type="checkbox"/> ફ્રી સ્ટાઈલ ૫૦મી <input type="checkbox"/> ફ્રી સ્ટાઈલ ૨૦૦મી <input type="checkbox"/> ફ્રી સ્ટાઈલ ૮૦૦મી બહેનો <input type="checkbox"/> ફ્રીસ્ટાઈલ ૧૫૦૦ મી ભાઈઓ <input type="checkbox"/> ફ્રીસ્ટાઈલ રીલે ૪ X ૧૦૦મી.
	<input type="checkbox"/> બ્રેસ્ટ સ્ટ્રોક ૫૦ મી <input type="checkbox"/> બેક સ્ટ્રોક ૨૦૦ મી <input type="checkbox"/> બટર ફ્લાય ૫૦મી <input type="checkbox"/> બટર ફ્લાય સ્ટ્રોક ૨૦૦ મી
	<input type="checkbox"/> બેક સ્ટ્રોક ૫૦ મી <input type="checkbox"/> બ્રેસ્ટ સ્ટ્રોક ૨૦૦ મી <input type="checkbox"/> મીડલે રીલે ૪ X ૧૦૦મી <input type="checkbox"/> વ્યક્તિગત મીડલે ૪૦૦ મી
જુડો	ભાઈઓ <input type="checkbox"/> ૭૩-૮૧ કિગ્રા સુ ધી <input type="checkbox"/> ૮૧-૯૦ કિગ્રા <input type="checkbox"/> ૯૦-૧૦૦ કિગ્રા <input type="checkbox"/> ૧૦૦ કિગ્રાથી ઉપર
	બહેનો <input type="checkbox"/> ૫૭-૬૩ કિગ્રા સુ ધી <input type="checkbox"/> ૬૩-૭૦ કિગ્રા <input type="checkbox"/> ૭૦-૭૮ કિગ્રા <input type="checkbox"/> ૭૮ કિગ્રા થી ઉપર
કુસ્તી	ભાઈઓ <input type="checkbox"/> ૭૪-૭૯ કિગ્રા <input type="checkbox"/> ૭૯-૮૬ કિગ્રા <input type="checkbox"/> ૮૬-૯૨ કિગ્રા <input type="checkbox"/> ૯૨-૯૭ કિગ્રા <input type="checkbox"/> ૯૭-૧૨૫ કિગ્રા
	બહેનો <input type="checkbox"/> ૫૯-૬૨ કિગ્રા <input type="checkbox"/> ૬૨-૬૫ કિગ્રા <input type="checkbox"/> ૬૫-૬૮ કિગ્રા <input type="checkbox"/> ૬૮-૭૨ કિગ્રા <input type="checkbox"/> ૭૨-૭૬ કિગ્રા
ટેકવેન્ડો	ભાઈઓ <input type="checkbox"/> ૪૮-૫૧ કિગ્રા <input type="checkbox"/> ૫૧-૫૫ કિગ્રા <input type="checkbox"/> ૫૬-૬૩ કિગ્રા <input type="checkbox"/> ૬૩-૬૮ કિગ્રા <input type="checkbox"/> ૭૩-૭૮ કિગ્રા <input type="checkbox"/> ૭૮ કિગ્રાથી ઉપર
	બહેનો <input type="checkbox"/> ૪૦-૪૨ કિગ્રા <input type="checkbox"/> ૪૨-૪૪ કિગ્રા <input type="checkbox"/> ૪૪-૪૬ કિગ્રા <input type="checkbox"/> ૪૬-૪૯ કિગ્રા <input type="checkbox"/> ૪૯-૫૨ કિગ્રા
આર્યરી	રીકર્વ રાઉન્ડ <input type="checkbox"/> વ્યક્તિગત ઓવરથ્રોલ <input type="checkbox"/> વ્યક્તિગત એલિમિનેશન રાઉન્ડ <input type="checkbox"/> ટીમ <input type="checkbox"/> મીક્સ ટીમ
	કમ્પાઉન્ડ રાઉન્ડ <input type="checkbox"/> વ્યક્તિગત ઓવરથ્રોલ <input type="checkbox"/> વ્યક્તિગત એલિમિનેશન રાઉન્ડ <input type="checkbox"/> ટીમ <input type="checkbox"/> મીક્સ ટીમ
જીમ્નાસ્ટીક	ભાઈઓ <input type="checkbox"/> ફ્લોર એક્સાઈઝ <input type="checkbox"/> વોલ્ટીંગ ટેબલ <input type="checkbox"/> રોમનરીંગ <input type="checkbox"/> પેરલલબાર <input type="checkbox"/> પોમોલોજીસ <input type="checkbox"/> હોરિઝોન્ટલબાર
	બહેનો <input type="checkbox"/> ફ્લોર એક્સાઈઝ <input type="checkbox"/> વોલ્ટીંગ ટેબલ <input type="checkbox"/> બેલેસીંગબીમ <input type="checkbox"/> અન ઈવનબાર
સ્કેટીંગ	સ્નોડ <input type="checkbox"/> રોડ ૧ (૩૦૦૦ મી.)
	ઈન લાઈન <input type="checkbox"/> રોડ ૨ (૫૦૦ મી.) <input type="checkbox"/> રોડ ૩ (૩૦૦૦ મી.)
આર્ટીસ્ટીક સ્કેટીંગ	<input type="checkbox"/> ફ્રી સ્કેટીંગ <input type="checkbox"/> સોલોડાન્સ <input type="checkbox"/> ફ્રીગર
સાઈકલિંગ	<input type="checkbox"/> ૨૦ કી.મી.
શુટીંગ	રાઇફલ ગ્રુપ <input type="checkbox"/> ૧૦ મી. પીપ સાઈટ એર રાયફલ <input type="checkbox"/> ૫૦ મી. ૦.૨૨ રાઇફલ ૩ પોજિશન
	પિસ્તોલ ગ્રુપ <input type="checkbox"/> ૧૦ મી. ૦.૧૭ એર પિસ્તોલ <input type="checkbox"/> ૨૫ મી. ૦.૨૨ રેપીડ ફાયર (ભાઈઓ) <input type="checkbox"/> ૨૫ મી. ૦.૨૨ સ્પોર્ટ્સ પિસ્તોલ (બહેનો)
	ટ્રેપ ગ્રુપ <input type="checkbox"/> શોટગન ટ્રેપ <input type="checkbox"/> શોટગન ડબલ ટ્રેપ
વેઈટલીફ્ટીંગ	ભાઈઓ <input type="checkbox"/> ૬૯ કિગ્રા સુ ધી <input type="checkbox"/> ૮૫ કિગ્રા <input type="checkbox"/> ૯૪કિગ્રા <input type="checkbox"/> ૯૪ કિગ્રાથી ઉપર
	બહેનો <input type="checkbox"/> ૫૮ કિગ્રા સુ ધી <input type="checkbox"/> ૬૩ કિગ્રા <input type="checkbox"/> ૬૯ કિગ્રા <input type="checkbox"/> ૬૯ કિગ્રાથી ઉપર
ફેન્સીંગ	<input type="checkbox"/> ફોઈલ <input type="checkbox"/> ઈપી <input type="checkbox"/> સેબર
બોક્સીંગ	ભાઈઓ <input type="checkbox"/> ૪૬-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૧ કિગ્રા <input type="checkbox"/> ૫૧-૫૪ કિગ્રા <input type="checkbox"/> ૫૪-૫૭ કિગ્રા <input type="checkbox"/> ૫૭-૬૦ કિગ્રા <input type="checkbox"/> ૬૦-૬૩.૫ કિગ્રા <input type="checkbox"/> ૬૩.૫-૬૭ કિગ્રા <input type="checkbox"/> ૬૭-૭૧ કિગ્રા <input type="checkbox"/> ૭૧-૭૫ કિગ્રા <input type="checkbox"/> ૭૫-૮૦ કિગ્રા
	બહેનો <input type="checkbox"/> ૪૫-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦-૫૨ કિગ્રા <input type="checkbox"/> ૫૨-૫૪ કિગ્રા <input type="checkbox"/> ૫૪-૫૬ કિગ્રા <input type="checkbox"/> ૫૬-૬૦ કિગ્રા <input type="checkbox"/> ૬૦-૬૩ કિગ્રા <input type="checkbox"/> ૬૩-૬૬ કિગ્રા <input type="checkbox"/> ૬૬-૭૦ કિગ્રા <input type="checkbox"/> ૭૦-૭૫ કિગ્રા

➢ જીમ્નાસ્ટીક સ્પર્ધામાં ખેલાડી કોઈ પણ બે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે
 ➢ શુટીંગ સ્પર્ધામાં સ્પર્ધકોએ શુટીંગ માટે પોતાની રાઈફલ લાવવાની રહેશે
 ➢ બધી જ સ્પર્ધાઓ ઈન્ટર નેશનલ શુટીંગ સ્પોર્ટ્સ ફેડરેશન (ISSF)ના નિયમો મુજબ યોજાશે
 ➢ શુટીંગ સ્પર્ધામાં રાઈફલ અથવા પિસ્તોલ અને ટ્રેપ ગ્રુપમાં કોઈપણ બે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે